



NAN-002-001605 Seat No. _____
B. Com. (Sem. VI) (CBCS) Examination
March / April - 2017
Fundamentals of Statistics - II
(New Course)

Faculty Code : 002
Subject Code : 001605

Time : $2\frac{1}{2}$ Hours] [Total Marks : 70

- સૂચના : (1) દરેક પ્રેશન ફરજિયાત છે.
(2) કેલક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ છે.

- 1 (અ) જીવનનિર્વાહના સૂચકાંક પર ટૂંકનોંધ લખો. 10
(બ) નીચેની માહિતી પરથી $L, P, F, D-B$ અને $M-E$ ના સૂચકાંકો
શોધો :

| વસ્તુ | 1970 | | 1975 | |
|----------|------|-------|------|-------|
| | ભાવ | જથ્થો | ભાવ | જથ્થો |
| <i>A</i> | 5 | 25 | 6 | 30 |
| <i>B</i> | 3 | 8 | 4 | 10 |
| <i>C</i> | 8 | 10 | 3 | 8 |
| <i>D</i> | 10 | 4 | 3 | 5 |

અથવા

- 1 (અ) સૂચકાંક શું છે ? સૂચકાંકની રૂચના કરવામાં ઉપસ્થિત થતાં વિવિધ 10
પ્રશ્નોની ચર્ચા કરો.
(બ) ભારિત ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરી નીચેની માહિતી માટે 10
જવનનિર્વાહનો સૂચકાંક શોધો :

| વસ્તુ | P_0 | q_0 | P_1 |
|-------|-------|-------|-------|
| A | 3 | 20 | 4 |
| B | 1.5 | 40 | 1.6 |
| C | 1 | 10 | 1.5 |

- 2 (અ) સમજાવો : ચલિત સરેરાશની રીત, ન્યૂનતમ વર્ગોની રીત. 10
(બ) નીચેની માહિતી પરથી દ્વિધાતી પરવલય વકનું અન્વાયોજન કરો : 10

| વર્ષ: | 1981 | 1982 | 1983 | 1984 | 1985 | 1986 | 1987 | 1988 | 1989 |
|-------|------|------|------|------|------|------|------|------|------|
| નફો: | 2 | 6 | 7 | 8 | 10 | 11 | 11 | 10 | 9 |

અથવા

- 2 (અ) સામયિક શ્રેષ્ઠીની વ્યાખ્યા સમજાવો. સામયિક શ્રેષ્ઠીનાં ઘટકો સંવિસ્તાર 10
સમજાવો.
(બ) મોસમી વધધટો શોધો :

| વર્ષ | Q_1 | Q_2 | Q_3 | Q_4 |
|------|-------|-------|-------|-------|
| 1980 | 30 | 35 | 36 | 38 |
| 1981 | 40 | 45 | 60 | 70 |
| 1982 | 76 | 80 | 90 | 95 |
| 1983 | 85 | 80 | 70 | 75 |

- 3 (અ) સારા નિર્દર્શનનાં લક્ષણો જણાવો. 7
- (બ) એક સમયીનાં 3 અવલોકનો 8, 10, 12 છે. તેમાંથી બે એકમોના 8
યાદચિક નિર્દર્શો પુરવણી સહિત કેટલા લઈ શકાય ? નિર્દર્શોની યાદી
બનાવી નીચેનાં પરિણામો ચકાસો :
- (1) નિર્દર્શ મધ્યકોનો મધ્યક સમચિ મધ્યક બરાબર થાય છે.

$$(2) V(\bar{y}) = \frac{N-n}{N} \times \frac{S^2}{n} \text{ મેળવો.}$$

અથવા

- 3 (અ) સમજાવો : નિર્દર્શન ભૂલો અને અનિર્દર્શન ભૂલો. 7
- (બ) સમચિનાં 10 અવલોકનોને બે સ્તરોમાં વહેંચવામાં આવે છે. પ્રથમ
સ્તરનાં અવલોકનો 15, 17, 9, 7 અને બીજા સ્તરનાં અવલોકનો 22, 26,
40, 32, 56, 64 છે. સ્તરિત યાદચિક નિર્દર્શ માટે પ્રથમ સ્તરમાંથી 2
અવલોકનો અને બીજા સ્તરમાંથી 3 અવલોકનો યાદચિક રીતે પસંદ કરવામાં
આવે તો સ્તરિત યાદચિક નિર્દર્શ મધ્યકનું વિચરણ શોધો.
- 4 (અ) ગુજરાત્મક સંબંધ સમજાવો. ગુજરાત્મક સંબંધના અત્યાસની યુલની રીત
સમજાવો. 7
- (બ) છોકરા અને છોકરીઓના સમૂહમાં કુલ 800 વિદ્યાર્થીઓ એક પરીક્ષામાં
બેઠા. છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં કુલ સંખ્યાના 15%
જેટલી વધારે હતી. પરીક્ષામાં પાસ થનારાઓની સંખ્યા નાપાસ થનારાઓની
સંખ્યા કરતાં 480 જેટલી વધારે હતી. પરીક્ષામાં નાપાસ થનાર છોકરા અને
છોકરીઓની સંખ્યા સરખી હોય તો આપેલ માહિતીને 2×2 ક્રોઝકમાં દર્શાવી
યુલનો ગુજરાત્મક સંબંધાંક શોધો.

અથવા

- 4 (અ) સમજાવો : સુરેખ આયોજનના ઉપયોગો. 7
 (બ) નીચે આપેલ માહિતી પરથી આલેખની રીતથી સુરેખ આયોજન પ્રશ્નનો 8
 ઉકેલ શોધો :

$x + y \leq 4, 3x + 8y \leq 24, x, y \geq 0$ શરતોને આધીન $Z = 5x + 7y$ ની
 કિંમત મહત્તમ થાય તે રીતે x અને y ની કિંમત શોધો.

ENGLISH VERSION

- Instructions :** (1) All questions are compulsory.
 (2) Use of calculator is allowed.

- 1 (a) Write note on cost of living index number. 10
 (b) From the following data find index numbers of
 $L, P, F, D - B$ and $M - E$:

| Item | 1970 | | 1975 | |
|------|-------|----------|-------|----------|
| | Price | Quantity | Price | Quantity |
| A | 5 | 25 | 6 | 30 |
| B | 3 | 8 | 4 | 10 |
| C | 8 | 10 | 3 | 8 |
| D | 10 | 4 | 3 | 5 |

OR

1 (a) What is Index number ? Discuss the different points that comes in the construction of an index number. **10**

(b) Construct the cost of living index number by using weighted geometric mean :

| Commodity | p_0 | q_0 | p_1 |
|-----------|-------|-------|-------|
| A | 3 | 20 | 4 |
| B | 1.5 | 40 | 1.6 |
| C | 1 | 10 | 1.5 |

2 (a) Explain : Method of Moving Average, **10**
Method of Least Square.

(b) From the following information, find $y = a + bx + cx^2$. **10**

| | | | | | | | | | |
|---------|------|------|------|------|------|------|------|------|------|
| Year: | 1981 | 1982 | 1983 | 1984 | 1985 | 1986 | 1987 | 1988 | 1989 |
| Profit: | 2 | 6 | 7 | 8 | 10 | 11 | 11 | 10 | 9 |

OR

2 (a) Explain Time series data and its components. **10**

(b) Find seasonal variations : **10**

| Year | Q_1 | Q_2 | Q_3 | Q_4 |
|------|-------|-------|-------|-------|
| 1980 | 30 | 35 | 36 | 38 |
| 1981 | 40 | 45 | 60 | 70 |
| 1982 | 76 | 80 | 90 | 95 |
| 1983 | 85 | 80 | 70 | 75 |

- 3** (a) Explain characteristics of a good sampling. **7**
- (b) Population of 3 units with values 8, 10, 12 write down all possible sample of sizes 2 by with replacement method. **8**
- Verify that :
- (1) Mean of sample mean and population mean are equal

$$(2) \text{ Find } V(\bar{y}) = \frac{N-n}{N} \times \frac{S^2}{n}.$$

OR

- 3** (a) Explain : Sampling and Non-sampling errors. **7**
- (b) 10 observations of a population are divided in two strata. **8**
- First strata having observations 15, 17, 9, 7 and second strata having observations 22, 26, 40, 32, 56, 64. Two observations are random selected from first strata and three observations from second strata. Find the variance of mean of stratified random sampling.
- 4** (a) Explain the association of attributes. Explain the Yule's method. **7**
- (b) 800 candidates of both sex appeared at an examination. **8**
- The boys out-numbered the girls by 15% of the total. The number of candidates who passed exceed the number failed by 480. Equal number of boys and girls failed in the examination. Prepare 2×2 table and find the Yule's coefficient of association.

OR

4 (a) Explain : Uses of Linear programming. **7**

(b) Solve the LPP by using graphical method. **8**

If $x + y \leq 4$, $3x + 8y \leq 24$, $x, y \geq 0$ then obtain the values of x and y , Maximize $Z = 5x + 7y$.
